



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૬/૦૮/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૭૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૨૨૨ લીટર દેશી દારૂ, ૧૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ મોટર સાયકલ અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧૪ કેસ કરી, ૭૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૭૯,૫૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૭૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૩૭૮/૧૯

ખાડીયા: મનીષભાઈ પોપટલાલ પટેલ (રહે. તુલીપ બંગલો વિભાગ-૨, સુરધારા સર્કલ પાસે થલતેજ) એ તા.૧૫/૦૮/૧૯ નારોજ ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૭/૧૯ સાંજના ૫/૧૫ વાગે રાયપુર શામળાની પોળ હવેલીની પોળ સામે મનીષભાઈની એ.પી જવેલર્સ નામની દુકાન ખાતે કારીગર આરોપી સંજયજી વદનજી ચાવડા (રહે. અજંતા ફ્લેટ તુલીપ બંગલોની બાજુમા સુરધારા સર્કલની બાજુમા થલતેજ) ને ચાંદી લેવા માટે રોકડ રૂપિયા ૧,૯૦,૦૦૦/- આપી માણેકચોક એમ.જી હવેલી રોડ ખાતે આવેલ ભારત બુલીયન નામની દુકાને મોકલેલ તે પરત નહી આવી રૂપિયા લઈ જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી યુ.એમ.નકુમ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૩૭૯/૧૯

કાલુપુર: વિશાલ સુરેશભાઈ પરમાર (રહે. શંકરનગર સોસાયટી પાલનપુર પાટીયા રંદેર રોડ સુરત) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૮/૧૯ કલાક ૫/૦૦ વાગ્યાના સુમારે કાલુપુર સ્વામિનારાયણ મંદીરના સભામંડપ ખાતેથી અજાણી વ્યક્તિ બેગની ચોરી કરી લઈ ગઈ છે. જે બેગમાં મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એમ.ચૌધરી ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૩૮૦/૧૯

સોલા હાઈકોર્ટ: તનુમતીબહેન પરેશભાઈ પટેલ (રહે. ચોરાવાળો વાસ સોલા ગામ સોલા) તા.૧૪/૦૮/૧૯ રાતના ૧૦/૧૫ વાગ્યાના સુમારે સોલા બાપા સીતારામની મઢલી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ તનુમતીબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ તનુમતીબહેન પટેલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૩૮૧/૧૯

જીઆઈડીસી વટવા: જીતલાલ બદલુ કુરમી (ઉ.વ.૨૧) (રહે.અસલમની ચાલી વટવા રેલ્વે સ્ટેશનની બાજુમાં વટવા) તા.૧૪/૦૮/૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે જીઆઈડીસી વટવા એમ.પી.ઇન્ડસ્ટ્રીઝ નામની રોલીંગ મીલમા રોલીંગ ઓપરેટર તરીકે કંપનીમા કામ કરતા હતા ત્યારે સ્ટીલના પતરાનો ટુકડો છાતીમાં વાગતા ગંભીર ઇજા થતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.સી.જાડેજા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.